

મિડલ ઈસ્ટનો તણાવ શેરબજારમાં તેજને રૂંધશે, સેન્સેક્સ-નિફ્ટી ઘટશે

મીડલ ઇસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ, કુડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને યુએસ કુગાવાના આંકડા તેમજ ફેડરલ રિઝર્વની આગામી બેઠકમાં વ્યાજદર અંગેનો નિર્ણય શેરબજારમાં તોફાની વધઘટ લાવશે. બજારના નિષ્ણાંતોનું માનવું છે કે, ભારતીય શેરબજારમાં લાર્જકેપ શેરોમાં તથા હેવીવેઇટ શેરોમાં ભારે વધઘટ ચાલુ રહેશે, પણ મિડકેપ તથા સ્મોલકેપ શેરોમાં આગામી સપ્તાહમાં ઉછળતા જોવા મળી શકે છે.

યુએસથી અપેક્ષિત કરતા વધુ ઉપર અસર રહેશે. જે ભારતના કુગાવો વધારી શકે છે. વિશ્વને યુદ્ધ અને મોંઘવારીના બખરમાં હોમી દેવાનો અને અમેરિકાને પણ પાચમાલ કરી દેવાનો બાણે દમ્પે નિર્ધાર કર્યો હોય એમ ઘરાનને હવે અફઘાનિસ્તાન બનાવી દેવા અમેરિકાએ શરૂ કરેલા અત્યંત ઘાતક હુમલાઓને જોતાં વિશ્વ અસાધારણ આર્થિક કટોકટીમાં ઘડેલાવાના સંકેત મળી રહ્યા છે. પશ્ચિમ એશિયાની કટોકટી, યુકેન અને રશિયાનું યુદ્ધ અને હવે અલનીનોના કારણે



પુરવઠો પુરો પાડનાર રશિયા અને વેનેઝુએલાના ઓઇલ ભંડારો પર કબજો કરીને અને ઘરાની ઘુંટણીયે લાવીને તેના ઓઇલ ભંડારો ઉપર કબજો કરવાનો બદ્દલો ઘરાવવું અમેરિકા ખુદ ડિઝાઇન પુરવઠાની જેના સોમનો કરવા માંડ્યું છે. જેના પરિણામો વિશ્વભરમાં ઈંદાણાના ભાવોમાં ભડકો થતા આ કટોકટીની પરિસ્થિતિના સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે. જે વૈશ્વિક બજારોના સેન્ટિમેન્ટને અત્યંત ખરાબ કરી શકે છે.

ભારતીય શેરબજારમાં 2026નું વર્ષ ડિફેન્સસેક્ટર માટે એક ઐતિહાસિક વર્ષનાં સાબિત થયું છે. સરકારના વધતા ખર્ચ, વૈશ્વિક તણાવ અને સ્થાનિક ઉત્પાદન પર ભારતે કારણે આ સેક્ટર રોકાણકારો માટે નવી આશાનું કેન્દ્ર બની ગયું છે. સરકારી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી



મેટલ્સ, ઇવી ઇન્ફ્રા, કન્સ્ટ્રક્શન ઇકવીપમેન્ટ, ટેલીકોમ નેટવર્કિંગ તથા એકેમસીજી તથા ફાર્મા શેરોમાં સુધારો જોવા મળી શકે છે. આ તમામ સેક્ટરમાં લાર્જકેપ શેરોની બદલ મિડકેપ અને સ્મોલકેપના પસંદગીના શેરોમાં જબરજસ્ત તેજી આવી શકે છે. બીજી તરફ, પ્રાયમરી બજારમાં પણ આગામી સપ્તાહમાં આઇપીઓની વેગાગાર આવી રહી છે. આ સિવાય મેગા આઇપીઓ એનએસઇ અને જિયો પ્લેટફોર્મની ટેચારી છે. સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં

જો તમે રૂ. બે કરોડના ભંડોળ સાથે નિવૃત્ત થઇ રહ્યા છો તો આટલું તમારે ધ્યાને લેવું જરૂરી છે



લે કરોડ રૂપિયા સાથે નિવૃત્તિ લેવી એ આશ્વાસન આપનારું લાગે છે, પરંતુ વાસ્તવિક પ્રશ્ન નિવૃત્તિ પછી શરૂ થાય છે: ભંડોળ વહેલું ખાલી કર્યા વિના તમે દર મહિને કેટલું ઉપાડી શકો છો? તેનો કોઈ એક જ જવાબ નથી કારણ કે પરિણામ નિવૃત્તિ સમયે તમારી ઉંમર, ખર્ચની જરૂરિયાતો, રોકાણ નિશ્ચય, ફુગાવો, કર અને પૈસા કેટલા સમય સુધી ટકી રહેવાની જરૂર છે. 6 ટકા, તેના પર આધાર રાખે છે. તાજેતરના નિવૃત્તિ માર્ગદર્શિકામાં પણ ભાર મૂકવામાં આવ્યો છે કે ઉપાડ દર ફક્ત આશોજનનો પ્રારંભિક ભિંદુ છે, ગેરંટી નહીં.

એક સરળ ઉદાહરણ તરીકે, 2 કરોડ રૂપિયામાંથી 3 ટકા વાર્ષિક ઉપાડથી વાર્ષિક આશરે 6 લાખ રૂપિયા અથવા શરૂઆતમાં દર મહિને 50,000 રૂપિયા મળશે. 4 ટકાના દરે, 6 લાખ રૂપિયા અથવા શરૂઆતમાં દર મહિને 66,667 રૂપિયા થશે. 5 ટકા ઉપાડનો અર્થ દર મહિને લગભગ 83,333 રૂપિયા થશે, જ્યારે 6 ટકા ઉપાડથી 1 લાખ રૂપિયા મળશે. જોકે, ઉપાડ જેટલો વધારે હશે, લાંબા નિવૃત્તિ દરમિયાન ભંડોળ પર દબાણ એટલું જ વધારે હશે. તાજેતરના ભારતીય નિવૃત્તિ વિશ્લેષણ સૂચવે છે કે લાંબા ગાળાના ટકાઉપણું ઇચ્છતા વ્યક્તિ માટે 3 ટકાથી 4 ટકા શરૂઆતી ઉપાડ વધુ સાવચેતીભર્યું હોઈ શકે છે. IIM અમદાવાદ દ્વારા ચર્ચા કરાયેલા એક ભારતીય અભ્યાસમાં દલીલ કરવામાં આવી છે કે યુએસ બજારના અનુભવમાંથી વિકસાવવામાં આવેલ વ્યાપકપણે ટાંકવામાં આવેલ 4 ટકાનો નિયમ ભારત માટે ખૂબ આકર્ષક હોઈ શકે છે અને ફુગાવા, બજારની અસ્થિરતા અને ઉપલબ્ધ

વળતરવાળી સંપત્તિમાં રાખવાથી બજારની અસ્થિરતા ઓછી થઈ શકે છે પરંતુ લાંબા નિવૃત્તિ સમયગાળા દરમિયાન ફુગાવાને વટાવી જવાનું ભંડોળ માટે મુશ્કેલ બની શકે છે. બીજી બાજુ, નિવૃત્તિ પછી તરત જ વધુ પડતું ઈક્વિટી એક્સપોઝર લેવાથી જો શરૂઆતના વર્ષોમાં બજારો તીવ્ર ઘટાડો થાય છે, તો ઉપાડને વળતરના કમના જોખમમાં મૂકી શકાય છે. એક વ્યવહારુ અભિગમ એ હોઈ શકે છે કે ભંડોળનો એક ભાગ નજીકના ગાળાના ખર્ચ માટે પ્રમાણમાં સ્થિર અને પ્રવાહી રોકાણોમાં રાખવો, જ્યારે બીજો ભાગ લાંબા ગાળાના વિકાસ માટે રોકાણ કરવો. ચોક્કસ ફાળવણી તમારી ઉંમર, જોખમ

નિવૃત્તિ ઉપાડ ઉંમર, ખર્ચ, ફુગાવા પર આધાર રાખે છે, બે કરોડ રૂપિયાનું નિવૃત્તિ ભંડોળ માસિક આવક પૂરી પાડી શકે છે, પરંતુ તમે કેટલી રકમ ઉપાડી છો, ફુગાવો અને રોકાણનું વળતર નક્કી કરશે કે પૈસા ખરેખર કેટલા સમય સુધી ટકી રહે છે. વળી તેમાં ભારતનો 4% નિયમ ખૂબ આકર્ષક હોઈ શકે છે



પ્રથમ વર્ષનો ઉપાડ વધીને આશરે 8 લાખ રૂપિયા અથવા દર મહિને 66,667 રૂપિયા થશે. 5 ટકા ઉપાડનો અર્થ દર મહિને લગભગ 83,333 રૂપિયા થશે, જ્યારે 6 ટકા ઉપાડથી 1 લાખ રૂપિયા મળશે. જોકે, ઉપાડ જેટલો વધારે હશે, લાંબા નિવૃત્તિ દરમિયાન ભંડોળ પર દબાણ એટલું જ વધારે હશે. તાજેતરના ભારતીય નિવૃત્તિ વિશ્લેષણ સૂચવે છે કે લાંબા ગાળાના ટકાઉપણું ઇચ્છતા વ્યક્તિ માટે 3 ટકાથી 4 ટકા શરૂઆતી ઉપાડ વધુ સાવચેતીભર્યું હોઈ શકે છે. IIM અમદાવાદ દ્વારા ચર્ચા કરાયેલા એક ભારતીય અભ્યાસમાં દલીલ કરવામાં આવી છે કે યુએસ બજારના અનુભવમાંથી વિકસાવવામાં આવેલ વ્યાપકપણે ટાંકવામાં આવેલ 4 ટકાનો નિયમ ભારત માટે ખૂબ આકર્ષક હોઈ શકે છે અને ફુગાવા, બજારની અસ્થિરતા અને ઉપલબ્ધ

ઉપાડ પરિણામને નોંધપાત્ર રીતે બદલી શકે છે. નિવૃત્ત લોકો ઘણીવાર ફુગાવાનો આંકડો ઓછો આંકે છે. જો તમારા પરિવારને આજે દર મહિને રૂ. ૭૦,૦૦૦ ની જરૂર હોય, તો તે રકમ ૧૫ કે ૨૦ વર્ષ પછી સમાન માલસામાનની ખરીદી કરશે નહીં. ઉંમર સાથે આરોગ્ય સંભાળ ખર્ચ પણ વધુ નોંધપાત્ર બની શકે છે. એટલા માટે સમયાંતરે ખર્ચ અને રોકાણોની સમીક્ષા કર્યા વિના નિશ્ચિત રકમ ઉપાડવાથી ખરીદ શક્તિ ધીમે ધીમે ઘટી શકે છે, ભલે નજીવી ભંડોળ સ્વચ્છ દેખાય. રોકાણ વ્યૂહરચના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સંપૂર્ણ રૂ. 2 કરોડ ઓછા

સહનશીલતા, અન્ય આવક અને નાણાકીય જવાબદારીઓને પ્રતિબિંબિત કરવી જોઈએ. પેન્શન આવક, ભાડાની આવક અથવા અન્ય ગેરંટીકૃત રોકડ પ્રવાહ પણ 2 કરોડ રૂપિયાના ભંડોળમાંથી ઉપાડવાની જરૂર પડતી રકમ ઘટાડી શકે છે. RBI ના તાજેતરના ડેટા દર્શાવે છે કે ઓગસ્ટ 2026 માં એક વર્ષથી વધુ સમય માટે બેંક ટર્મ-ડિપોઝીટ દર લગભગ 6 ટકાથી 6.75 ટકા હતા, જે દર્શાવે છે કે નિવૃત્ત લોકોએ ફક્ત એવું માનીને કે ફિક્સ્ડ ડિપોઝીટ અનિશ્ચિત સમય માટે પૂરતી આવક ઉત્પન્ન કરશે તેના બદલે કર પછીના વળતરની તુલના કેમ કરવી જોઈએ.

અલ નીનોની અસર, જળ વિદ્યુતનું ઉત્પાદન ઘટતા વીજળીનું સંકટ સર્જાશે

અલ નીનોની અસર કૃષિ ઉત્પાદન ઉપર જ સીમિત રહી નથી, પણ નબળા ચોમાસાના કારણે જળવિદ્યુત ઉત્પાદન ઉપર મોટી અસર થવા પામી છે. જળાશયો અને નદીઓના પાણીના નીચા સ્તરના કારણે જળવિદ્યુત ઉત્પાદન ઓછી થઈ રહી છે. એકબાજુ અલ નીનોના કારણે ચોમાસુ નબળું પડ્યું છે અને તેથી ખેડૂતોને ખેતી માટે પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે વીજળીની માગ વધી રહી છે. બીજી તરફ, જળવિદ્યુત ઉત્પાદન ઘટી રહ્યું છે તેથી દેશમાં વીજ સંકટ તોળાઈ શકે તેવા અંધાણ વર્તાઈ રહ્યા છે. એક અહેવાલ અનુસાર અહેવાલ આપ્યો છે કે, ગત મહિનાનો વરસાદ લાંબા ગાળાના સરેરાશ કરતા 16 ટકા જેટલો ઓછો થયો હતો. જેનું મુખ્ય કારણ અલ નીનોના લીધે હવામાનમાં



ફેરફાર છે. સામાન્ય કરતા નબળા ચોમાસાના કારણે તાપમાનમાં પણ વધારો થયો છે. ખેડૂતો સિંચાઈ માટે વીજળીનો વપરાશ વધારી રહ્યા છે. જેના કારણે વીજ માગમાં પણ વૃદ્ધિ થઈ છે. જોકે, સૌર ઊર્જાના લીધે થોડીક માગમાં રાહત જોવા મળી રહી છે. આ વર્ષની શરૂઆતમાં, જળ વિદ્યુતની અછતને પહોંચી વળવા માટે સરકારે વરસાદની ઋતુ દરમિયાન પણ કોલસા આધારિત મોટા પાવર પ્લાન્ટને કાર્યરત રાખવા માટે કટોકટીના નિયમો લંબાવવા પડ્યા હતા. છેલ્લા 12 વર્ષના ઇતિહાસમાં જુન

મહિનામાં જળવિદ્યુત ઉત્પાદનમાં સૌથી મોટો ઘટાડો જોવાયો હતો.



જે 21 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. ફેબ્રુઆરી, 2024 પછી આ સૌથી મોટો ઘટાડો હતો. જુલાઈમાં વરસાદમાં સુધારો થયો હતો, પરંતુ ઓગસ્ટમાં ફરી નબળો પડ્યો હતો. જુનથી સપ્ટેમ્બર મહિના સુધીના સમયગાળા દરમિયાન સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

નબળા ચોમાસાના લીધે ખેડૂતો સિંચાઈ માટે વીજ માગમાં વૃદ્ધિની સામે ઓછું વીજ ઉત્પાદન સંકટ પેદા કરશે

ટકા છે. છેલ્લા દાયકામાં ભારતની હાઈડ્રો પાવર ક્ષમતામાં લગભગ પાંચમાં ભાગનો વધારો થયો છે. નવીનીકરણીય અને પરમાણુ ઊર્જા જેવા મુખ્ય સ્વચ્છ ઊર્જાસ્ત્રોતોમાં આ સૌથી ધીમી વૃદ્ધિ છે. દેશની 52 ઊંડાવોટ ક્ષમતાનો મોટો હિસ્સો નદીના પ્રવાહ પર

આધારિત છે. તે મોટા જળાશયો કરતા નદીના કુદરતી પ્રવાહ પર આધાર રાખે છે. હિમાલયના પ્રોજેક્ટ્સ ઉનાળામાં બરફ પીગળવાથી લાભ મેળવે છે. જ્યારે અન્યત્ર બેસીન મોટાભાગે વરસાદ પર આધાર રાખે છે. જુલાઈ મહિનામાં થોડા સમય માટે વરસાદ ઓછો થયો હોવાથી ભારતનું હાઈડ્રોપાવર ઉત્પાદન દબાણ હેઠળ છે. આના કારણે ગ્રીડને ઊંચી વીજળીની માગ વચ્ચે ઓછા હાઈડ્રોપાવર સપ્લાયનું સંચાલન કરવાની ફરજ પડી છે.

ભારત-ફ્રાન્સ ટેક્સટાઈલ અને ફેશન સહયોગ કરાર કાપડ ઉદ્યોગમાં નવી વૈશ્વિક તકો ઉભી કરશે

ભારત ટેક્સ ટ્રેડ ફેડરેશન (BTTF) અને પ્રીમિયર વિઝન SA, સર્જનાત્મક ફેશન, કાપડ અને સોર્સિંગ માટે વિશ્વના અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૈકીના એક, એ 2 સપ્ટેમ્બર, 2026 ના રોજ પ્રીમિયર વિઝન (પેરિસ) પ્રદર્શનમાં વૈશ્વિક ફેશન અને કાપડ ઇકોસિસ્ટમ સાથે ભારતના જોડાણને મજબૂત બનાવવાના હેતુથી બહુ-વર્ષીય સંસ્થાકીય ભાગીદારી સ્થાપિત કરવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા.

ભારત-ફ્રાન્સ ટેક્સટાઈલ અને ફેશન સહયોગ કરાર કાપડ ઉદ્યોગમાં નવી વૈશ્વિક તકો ઉભી કરશે. આ વ્યૂહાત્મક એમઓયુ પ્રીમિયમ ફેશનમાં ભારતીય કાપડ ઉદ્યોગ માટે વૈશ્વિક તકો ઊભી કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારી, ભારતીય કાપડ ઉદ્યોગ ઉચ્ચ કક્ષાની વૈશ્વિક ફેશનમાં ગતિ મેળવશે.

સાહસોને વૈશ્વિક બજારની માંગ સાથે સંરેખિત થવા અને ટકાઉ, ઉચ્ચ-ગુણવત્તાવાળા સોર્સિંગ સોલ્યુશન્સ શોધતા ખરીદદારો સાથે સંબંધો બનાવવા માટે સમર્થન આપશે. જાન્યુઆરી 2026 માં ભારત-EU મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો પૂર્ણ થયા પછી આ ભાગીદારી એક મહત્વપૂર્ણ તબક્કે આવી છે. કરારે ભારતની 99.5% નિકાસને આવરી લેતી 96.8% ટેરિફ લાઈન પર પસંદગીની બજાર એક્સેસ પ્રદાન કરી હતી, જેમાં વેપાર મૂલ્ય દ્વારા

પ્રીમિયમ ફેશનમાં ભારતીય કાપડ ઉદ્યોગ માટે વૈશ્વિક તકો ઊભી કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારી, ભારતીય કાપડ ઉદ્યોગ ઉચ્ચ કક્ષાની વૈશ્વિક ફેશનમાં ગતિ મેળવશે

ઉત્પાદકો, નિકાસકારો, ડિઝાઈનર્સ અને કારીગરોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો, ફેશન હાઉસ અને પ્રીમિયમ સોર્સિંગ નેટવર્ક્સ સાથે જોડાવા માટે એક મુખ્ય માર્ગ પૂરો પાડે છે. મુખ્ય વ્યૂહાત્મક ઉદ્દેશ્ય ભારતને વોલ્યુમ-આધારિત નિકાસથી આગળ વધીને ઉચ્ચ-મૂલ્ય, ડિઝાઈન-આધારિત અને પ્રીમિયમ સેગમેન્ટ્સ તરફ લઈ જવાની સુવિધા આપવાનો છે. પ્રીમિયર વિઝનના ટ્રેન્ડ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ભારતીય

90.7% નિકાસ અમલમાં આવ્યા પછી ઝબુટી-મુક્ત થવાની અપેક્ષા છે. કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર માટે, આ તક ખાસ કરીને મહત્વપૂર્ણ છે. 2025 માં EU ની વૈશ્વિક કાપડ અને વસ્ત્રોની આયાત આશરે US\$292.8 બિલિયન હતી, જ્યારે ભારતની કાપડ અને વસ્ત્રોની નિકાસ હાલમાં EU માં લગભગ US\$10.4 બિલિયન છે. તેથી, ભારત-EU FTA દ્વારા કાપડ અને કપડાંની ટેરિફ લાઈનમાં શૂન્ય-ઝબુટી એક્સેસનો પ્રસ્તાવ



ફુદરતી પ્રગતિ છે, જે ભારતના વૈભવી કાપડ અને સમૃદ્ધ વારસાને યુરોપ અને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે નવી તકો ઊભી કરે છે, જ્યારે દેશભરના કારીગરો, વણકારો, ડિઝાઈનર્સ, મહિલા ઉદ્યોગસાહસિકો અને MSME ને લાભ આપે છે.” BTTF ના કોર કમિટી સભ્ય ડૉ. એ. શક્તિવેલે કહ્યું હતું કે: “પ્રીમિયર વિઝન સાથેની આ ભાગીદારી ભારતીય કાપડને વૈશ્વિક બજારો સાથે વધુ નજીકથી જોડશે, તરફ લઈ જવાની સુવિધા આપવાનો છે. પ્રીમિયર વિઝનના ટ્રેન્ડ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ આગળ વધારશે, સ્પર્ધાત્મક અને જવાબદાર



કાપડ હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે.” પ્રીમિયર વિઝનના ફેશન ડિવિઝનના સીઈઓ શ ફ્લોરેન્સ રુસેનેનું કેટલું હતું કે, “અમને એમઓયુ હેઠળ, બંને સંસ્થાઓ આ જવાબદાર સોર્સિંગને પ્રોત્સાહન આપવા માટે BTTF સાથે ભાગીદારી

કરવાનો આનંદ છે, જ્યારે ટેક્સટાઈલ મૂલ્ય શૃંખલામાં ભારતીય અને ફ્રેન્ચ હિસ્સેદારો માટે નવી તકો ઊભી થાય છે.સંયુક્ત સંચાલન સમિતિ દ્વારા દેખરેખ રાખવામાં આવનાર આ માટે સંયુક્ત નિકાસ પ્રોત્સાહન પહેલ, જેમાં ખરીદનાર-વેચાણકર્તા બીટિંગ અને રિવર્સ ખરીદનાર-

પ્રતિનિધિમંડળો, વક્તાઓ અને નિષ્ણાંતોની પારસ્પરિક ભાગીદારી, સંયુક્ત નિકાસ પ્રોત્સાહન અને બજાર જોડાણો: બજારની પહોંચ વધારવા માટે સંયુક્ત નિકાસ પ્રોત્સાહન પહેલ, જેમાં ખરીદનાર-વેચાણકર્તા બીટિંગ અને રિવર્સ ખરીદનાર-

અને સોર્સિંગ નેટવર્ક સાથે જોડીને, આ ભાગીદારી ભારતીય સાહસોને ઉચ્ચ-મૂલ્યના આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવા અને વૈશ્વિક ફેશન ઉદ્યોગ માટે ટકાઉ, નવીન અને ઉચ્ચ-મૂલ્યના સોર્સિંગ સ્થળ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.